



ઉમા કો-ઓપરેટીવ બેંક લિ., વડોદરા.

હેડ ઓફિસ: જય કોમ્પ્લેક્સ, ડીલશ ચાર રસ્તા, નિઝામપુરા, વડોદરા - ૩૯૦ ૦૦૨.

ઘીકલ (મોટર, રીશા, ટ્રક વગેરે) માટે નાણાંકીય સહાય મેળવવાનું અરજી પત્રક

શ્રી મેનેજર/મેનેજર ડિરેક્ટર

ઉમા કો-ઓપરેટીવ બેંક લિ.,

વડોદરા - ૩૯૦ ૦૦૨.

મહેરબાનશ્રી,

હું/અમો આ અરજી પત્ર દ્વારા જા. _____ અંક રૂપિયા _____
ની _____ હેતુ માટે લોન મેળવવા અરજી કરું છું/કરીએ છીએ.

આપે માર્ગથી મુજબની વિગતો નીચે મુજબ છે.

(૧) અરજદારનું નામ :

(૨) ઉંમર :

(૩) પુરુષ સરનામું :

(૪) અરજદારનો ધંધો વ્યવસાયની વિગત :

ધંધા/નોકરીનું સરનામું :

(૫) (A) અરજદારની માસિક આવક જા. _____ પ (B) ટેલીફોન નં.: (૦) _____ (R) _____

(પગાર સ્ટાફીકેટ અથવા ઇન્કમટેક્ષના છેલ્લા ઓર્ડરની નકલ સામેલ કરવી) (M) _____

(૬) અરજદારે આ બેંકમાંથી લોન લીધી હોય તો તેની વિગત :

કંઈ લોન _____ રકમ જા. _____ આજ રોજ બાકી રકમ જા. _____

(૭) અરજદારે અન્ય બેંકમાંથી લોન લીધી હોય તો તેની વિગત : બેંક _____ રકમ જા. _____

(૮) અરજદારનો માસિક કુલ ખર્ચ જા. _____

(૯) અરજદારની જામીનદાર તરીકે જવાબદારી (૧) નામ _____ (૨) નામ _____

સભાસંદ નં. _____ સભાસંદ નં. _____

(૧૦) અરજદારની વડોદરા શહેરની સ્થાવર મિલકતની વિગત :

(સુધારાઈ વેરો ભર્યાની પાવતી સામેલ કરવી)

(૧૧) કચા વાહન માટે લોનની માંગણી કરી છે તેની વિગત :

વાહનની મૂળ કિંમત :

વાહન કચાંથી ખરીદવાનું છે :

(વાહનનું પ્રકોર્ડ ઇન્વોઇસ (ક્વોટેશન) અથવા જૂના માટે વેલ્યુઅશન સ્ટાફીકેટ રજૂ કરવું)

(૧૨) સૂચિત જામીનદારોની વિગત :

(A) જામીનદારનું નામ તથા સરનામું (૧) _____ (૨) _____

(B) જામીનદારની ફરજીયાત બચત (૧) નં. _____ (૨) નં. _____

રકમ જા. _____ રકમ જા. _____

(C) જામીનદારની સ્થાવર મિલકતનું વર્ણન (૧) જા. _____ (૨) જા. _____

(પાવતી સાથે)

(D) જામીનદાર નોકરી કરતા હોય તો (૧) _____ (૨) _____

માસિક આવક (પગાર સ્લીપ રજૂ કરવી)

(E) જામીનદાર અન્ય કોઈમાં જામીન (૧) નામ _____ (૨) નામ _____

હોય તો વિગત

સભાસંદ નંબર _____ સભાસંદ નંબર _____

(૧૬) અરજદારની દરમાસની સરેરાશ કમાણી અને તેમાંથી સરેરાશ ખર્ચની વિગત નીચે પ્રમાણે આપો.

(A) આવક :

- (૧) માસમાં કેટલા દિવસ વાહન ઉપયોગમાં રહેશે.
- (૨) દર્શોજ કેટલા કિલોમીટર સરેરાશ વીકલ ફરશે.
- (૩) દર્શોજની અંદાજુ આવક
- (૪) જ્યાં દર્શોજની ટ્રીપ મારવાની હોથ ત્યાં ટ્રીપ પ્રમાણે અંદાજુ આવક રૂ. _____ (કુલ આવક)

(B) ખર્ચ માસીક અંદાજુત :

(૧) દિવસ × કિલોમીટર × પેટ્રોલ કે ડીજલ :	પેટ્રોલ/ડીજલ ખર્ચ રૂ.
એક લિટર પેટ્રોલ કે ડીજલ સરેરાશ કિ લોમીટર કાપે.	
(૨) ડ્રાઇવર કંડકટરના પગાર ભથ્થા વગેરે (એવેજ)	રૂ.
(૩) ઓઈલની કિંમત તથા અન્ય ખર્ચ	રૂ.
(૪) વીમા પ્રિમિયમ	રૂ.
(૫) મોટર ટેક્ષા (આર.ટી.ઓ. તથા એચ્.ટેક્ષા)	રૂ.
(૬) ગેરેજ ભાડું	રૂ.
(૭) નિભાવ ખર્ચ, રીપેરીંગ સર્વિસ વગેરે	રૂ.
(૮) ઉદ્દીનાં નાણાં પર વ્યાજ	રૂ.
(૯) વાર્ષિક ઘસારો ૨૦% પ્રમાણે	રૂ.
(૧૦) બીજા ખર્ચ માહિતી સાથે	રૂ.
(૧૧) અંગત નિભાવ ખર્ચ	રૂ.
	કુલ ખર્ચ
કુલ આવક, બાદ કુલ ખર્ચ = વધારો	રૂ.
અન્ય આવકના પ્રકાર રકમ સાથે	રૂ.
	ત્રોસ આવક
	રૂ.

અરજદારની સહી

આથી હું / અમો નીચે સહી કરનાર ઉપર જણાવેલી તોન લેવા અરજુ કરી છે તેમાં જણાવેલી હકીકત ખરી અને સાચી છે. તેમ કબુલ કરું છું / કરીએ છીએ. તેમજ જણાવું છું / જણાવીએ છીએ કે બેંકના આ અંગેના જે તે વખતના અમલમાં હોથ તે નિયમો તથા પેટા નિયમો મને/અમને કબુલ મંજુર છે.

જો મને / અમોને ધિરાણ આપવામાં આવશે તો બેંકના જણાવ્યા મુજબ વાહન બેંકના ઇન્સ્પેક્શન માટે તેની મુખ્ય ઓફિસ કે બ્રાન્ચ ઓફિસે દર છ માસ કે ઓછા સમયાંતરે રજુ કરીશ/કરીશું તે માટે બંધાઉ છું/બંધાઈએ છીએ અને ઇન્સ્યુરન્સ તેમજ અન્ય જરૂરી પેપર્સ નિયમીત રજુ કરીશું.

તારીખ :

આપનો વિશ્વાસુ,

અરજદારની સહી

જો અરજદાર ભાગીદારી પેઢી હોથ તો બધા ભાગીદારોએ સિક્કો મારી સહી કરવી તેમજ ભાગીદારી સ્ટેમ્પની નકલ અને ભાગીદારી પેઢીનો નોંધાણી નંબર જણાવવો.

ઉપરોક્ત અરજદારશ્રી

ના _____ ધિરાણ માંગતી અરજુ અનુસંધાનમાં અમો નીચેના જામીનદારો સ્વખુશીથી જામીનગરી સ્વીકારવા માટે સંમત છીએ.

જામીનદારનું નામ (૧) _____ સહી _____
(૨) _____ સહી _____

તારીખ :